

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ઓટો ઇન્સ્યુરન્સના રેટ્સ વ્યાજબી રાખવાની હિમાયત કરે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 26, 2021) – આપણાં પ્રોવિન્સમાંના રહેવાસીઓ સૌથી વધારે ઓટો ઇન્સ્યુરન્સ રેટ્સ ચૂકવે છે, અને આ દરો સતત વધી રહ્યાં છે ત્યારે, સીટી ઓફ બ્રેમ્પટન ઓન્ટેરિયોમાં ઓટો ઇન્સ્યુરન્સ દરોની સમીક્ષા અને સુધારો કરવા પ્રોવિન્સની સરકારને કહી રહ્યું છે.

આજરોજ, સીટી કાઉન્સિલે બ્રેમ્પટનવાસીઓ માટે ઓટો ઇન્સ્યુરન્સ રેટ્સ વ્યાજબી રાખવાની હિમાયત કરવા **#FairDealForBrampton** ઝુંબેશ શરૂ કરી. ઓટો ઇન્સ્યુરન્સ કૌટુંબિક ખર્ચાઓમાં મોટો ભાગ હોય છે, અને બ્રેમ્પટનવાસીઓ સરેરાશ ઓન્ટેરિયો ડ્રાઇવર કરતા લગભગ 123 ટકા વધારે દરો ચૂકવે છે.

બ્રેમ્પટન ચાલકો શહેરભરમાં પોસ્ટલ કોડ્સ પ્રમાણે ઓટો ઇન્સ્યુરન્સ રેટ્સ બદલાતા હોવાનું જુએ છે, જેમાં દરો \$3,301 જેટલા વધારે છે, જે પ્રોવિન્સની સરેરાશ કરતા બે ગણાથી વધારે છે. રહેવાસીઓ હમણાં નિર્ણય લઈ શકે છે અને શહેરની **#FairDealForBrampton** ઝુંબેશને નીચે જણાવ્યા પ્રમાણે ટેકો આપી શકે છે:

- સીટી ઓફ બ્રેમ્પટનની વેબસાઇટ પરની [ઓનલાઇન પિટિશન](#) પર સહી કરવી, જે તમારા સ્થાનિક મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ (MPP) ને સંબોધવામાં આવે, જેના થકી તેઓ જાણે કે તેઓ બ્રેમ્પટન માટે ઉકેલનો ભાગ બને તેવી તમારી અપેક્ષા છે. સીટી પોતાને મળેલી બધી પિટિશન્સ એકઠી કરીને સંબંધિત MPPs ને રજૂ કરશે.
- ઝુંબેશ **#FairDealForBrampton** નો શબ્દ પડોશીઓ, કુટુંબીજનો અને મિત્રો સાથે [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર વહેંચવામાં અને સૌથી અદ્યતન સમાચાર, ઝુંબેશ પર ચાવીરૂપ લેકીકતો અને માહિતી પર અદ્યતન રહેવામાં મદદરૂપ થાવ. ઝુંબેશ પર વધુ માહિતી મેળવવા બ્રેમ્પટનની **#FairDealForBrampton** વેબસાઇટ જોવા [અહીં](#) ક્લિક કરો.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન, અને ઓન્ટેરિયો આસપાસના કુટુંબો, COVID-19 મહામારીથી ઉદભવેલા નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યાં છે ત્યારે, સરકારોએ ઓટો ઇન્સ્યુરન્સના વધતા જતા ખર્ચાઓને સંબોધવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું રહ્યું. ફેરફાર લાંબા સમયથી થવાનો બાકી છે અને આપણે ઇન્સ્યુરન્સ રેટ્સ નિર્ધારિત કરવામાં પોસ્ટલ કોડનો ભેદભાવ સમાપ્ત કરવો રહ્યો. સાથે મળીને, બ્રેમ્પટનવાસીઓ આસમાનને આંબતા ઇન્સ્યુરન્સ રેટ્સ પર નિર્ણય લઈ શકે છે અને **#FairDealForBrampton** મેળવી શકે છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટન ચાલકો બહુ લાંબા સમયથી માત્ર પોસ્ટલ કોડ્સને લીધે બાકીના પ્રોવિન્સ કરતા બહુ વધારે ઓટોમોબાઇલ ઇન્સ્યુરન્સ રેટ્સ ચૂકવી રહ્યાં છે. હવે પ્રોવિન્સની સરકાર માટે ઓટોમોબાઇલ ઇન્સ્યુરન્સ રેટ્સની સમીક્ષા અને સુધારો કરવા પોતાનું વચન નિભાવવાનો સમય આવી ગયો છે. આપણને **#FairDealForBrampton**” મળે તેનો સમય હવે આવી ચૂક્યો છે.

- *ગુરપ્રીત ધિલ્લોન (Gurpreet Dhillon), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું



Media Release

નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca